

**મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા દ્વારા મકાઈની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ.**

પંચમહાલ જીલ્લાના મુખ્ય પાક એવા મકાઈ પાકના વધુ ઉત્પાદન માટે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા દ્વારા અત્રેના કેન્દ્ર ખાતે તા.૧૫/૦૯/૨૦૧૮ ના રોજ મકાઈની વૈજ્ઞાનિક ખેતી અંગે ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સેક્યુરિટી (એફ.ઈ.એસ), દાહોદ દ્વારા સંતરામપૂર જિલ્લાના બાબરોલ ગામના ૫૦ જેટલા ખેડૂત-મિત્રો માટે તાલીમનું આયોજન કરેલ હતું.

ખેડૂતોને મકાઈની આધુનિક તાંત્રિકતાઓથી વાફેક કરવા એ ખુબ જ અગત્યનું હોઈ આ અંગેની તાલીમ આપવા શ્રી સત્યનામ સાહેબ જળસ્રાવ વિકાસ જુથ, બાબરોલ દ્વારા અત્રેના કેન્દ્ર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૦ જેટલા ખેડૂતમિત્રોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ.પી.કે.પરમાર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (બ્રિડિંગ) એ મકાઈમાં બીજ ઉત્પાદન અને સીડ વિલેજ પ્રોગ્રામની માહિતી આપેલ હતી.

પ્રો.કે.એચ.પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એગ્રો) દ્વારા મકાઈમાં રસાયણિક ખાતરનો જુદી-જુદી અવસ્થા દરમ્યાન વપરાશ અંગે સચોટ માર્ગદર્શન આપેલ હતું અને વૈજ્ઞાનિક અને નફાકારક ખેતી પદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી, તેમજ ડૉ.બી.એન.ઠક્કર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા મકાઈમાં ક્ષેત્રીય નિદર્શનથી થતા ફાયદાઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી.

ડો.એચ.એસ.વર્મા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટો) દ્વારા મકાઈમાં આવતી જીવાતોનું સંકલિત નિયંત્રણ વિષે વિસ્તૃતમાં માહિતી આપી.

પ્રો.ડી.એમ.રાહોડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (વિસ્તરણ) દ્વારા મકાઈ પાકમાં જૈવિક ખાતરનું મહત્વ તથા બાયોફર્ટીલાઈઝરનો ઉપયોગ કરી રસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરીને ખેતી ખર્ચ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ડી.એમ.રાહોડે કરેલ હતું.

